

An ISO 9001 Certified Company
Government Recognized One Star Export House

Corporate Office:

2nd Floor, Mrudul Tower, B/h. Times of India, Ashram Road, Ahmedabad - 380 009, Gujarat, INDIA.

Tel.: +91-79-66614508 E-mail: info@gyscoal.com

Web.: www.gyscoal.com

CIN: L27209GJ1999PLC036656

Regd. Office & Factory:

Ubkhal, Kukarwada - 382 830, Tal.: Vijapur, Dist.: Mehsana,

Gujarat, INDIA.

Tel.: +91-2763-252384 Fax: +91-2763-252540

E-mail: info@gyscoal.com

May 6, 2023

To.

Bombay Stock Exchange Limited

1st Floor, New Trading Ring, Rotunda Building, P. J. Tower, Dalal Street, Mumbai – 400 001.

Scrip Code: 533275

To.

National Stock Exchange of India Ltd.,

Exchange Plaza, C-1, Block G, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 051

Company Symbol: GAL

SUB.: <u>Submission of copy of Advertisement of Corrigendum of Notice of Extra Ordinary General Meeting (EGM) of Company.</u>

With reference to above, we are enclosing copy of Advertisement of corrigendum for Notice of Extra Ordinary General Meeting (EGM) of Company published in Business Standard (English) and Jai Hind (Gujarati) on May 06, 2023 of Gyscoal Alloys Limited pursuant to relevant Regulation of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for your information and record please.

This is for your kind perusal and record. Kindly acknowledge the receipt of above.

Thanking you.

Yours faithfully,

For, Gyscoal Alloys Limited

Hiral Patel

Company secretary and Compliance office

(Membership No. A56573)

Encl: As above

PUBLIC NOTICE

In the Reg. Dist. Vadodara, Sub Dist. Vadodara, Mouje Village Bapod, R S No. 715, 719 paiki, C S No.230 whereof Dharti Tenements is situated consist of Sub Plot No.D/26 which is purchase by Shantaben Balubhai Bariya & Balubhai Kevalbhai Bariya through Sale Deed dated 17.10.2002 registered before SRO, Vadodara under its Reg. No.6910 and said Original Sale Deed, which is lost/misplaced by the present owners. Therefore in this case, if any Nationalize Bank, Individual Bank or any Financial Institution has its charge, right or lien on the above Original Sale Deed or on property, then within 07 days from the publication of this notice, may send their objections along with the supportive evidence. If not sent within given period of time, then my client will initiate further proceedings and to get title clearance certificate.

Date - 06-05-2023.

As per instruction of my client.

KAMAL B. PANDYA (ADVOCATE) Office:- "SANKALP", Second Floor, Marimata's Lane Rajmahal Road, Vadodara-01. Mo. 9825802142

STATE BANK SMALL & MEDIUM ENTERPRISE CITY CREDIT CENTRE 319-323, D- WING, 3rd FLOOR, ITC BUILDING, MAJURA GATE OF INDIA SURAT - 395002, E-mail - sbi.05020@sbi.co.ii Notice u/s 13(2) of Securitisation and Reconstruction of

Financial Assets and Enforcement of Security Interest Act, 2002 Dear Sir(s), (1) M/s V S Fashion: Proprietor: Sh. Bharathhai Punabha Sabhadiya, 12, 3rd Floor, Vrunda Embro Park, Near Shubham Industrial Park Saniya Hemad Gam, Saniya- Kadodra Road, Surat- 395006 & (2) Sh. Bharatbhai Punabhai Sabhadiya; Proprietor of M/s VS Fashion, Flat No. 504, Shiv Dhara Residency, B/h Vanmali society, Yogi Chowk, Puna, Surat. Availed Credit Facilities from State Bank of India, KATARGAM, BRANCH, SURAT and SMECCC Branch, Surat. The Credit facilities are secured by mortgage of the following assets

Description of Property (Part I:) Hypothecation of Machinery: Computerised Embroidery Machine 9 Needle

23 Heads 400x850x1500 With Easy Cording, With Dual Sequins, With Trimmer, With Standard Accessories of Brand: Sinsim Liberty. (Part II:) All rights title and interest in residential Flat No. 504, on the 5th Floor, of

the Building No. A of the project known and named as "SHIV DHARA RESIDENCY" situated at Puna, land bearing Revenue Survey No. 161, Block No 190 Paikee, T.P. Scheme No. 60 (Puna). Final Plot No. 62/C admeasuring 6348.00 Sq. mtrs Paikee Sub-plot No.1 admeasuring 2500.00 Sq.mtrs of Village: Puna, Taluka: Puna (Surat City), District: Surat. Flat Super Built Up area admeasuring 980.00 Sq.fts and Built Up Area admeasuring 594.71 Sq.fts i.e. 55.27 Sq.mtrs along with undivided proportionate share admeasuring 28.39 Sq.mtrs in underneath land thereon You created mortgage of the above property. As you failed to adhere to the terms of

the sanction EB-MSME-TL Account Number: 40185140540 (Sanctioned Limit Rs.38,29,643/-), the account is now irregular and the debt has been classified as Non performing asset on 08/01/2023, in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of principal debt and interest thereon. Therefore, the bank hereby calls upon you u/s 13(2) of the SARFAESI Act, 2002 by issuing this Demand Notice No. SMECCC/SURAT/2023-24. Dated 04.05.2023 as the notice sent to above mentioned address was returned undelivered. Your outstanding liabilities (in aggregate) due and owing to the bank is sum of Rs.40,56,672.00 (Rupees Forty Lacs Fifty-Six Thousands Six Hundred and Seventy Two Only) as on 04.05.2023 in EB-MSME-TL Account Number.: 40185140540 , plus future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges & any liability caused to bank due to litigation in the account etc. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc within 60 days from the date of this notice falling which the undersigned may be constrained to initiate action under the said act to enforce the aforesaid securities.

Date : 04/05/2023 Place :Surat

Sd/- Authorized Officer, State Bank of India, SMECCC Branch, Surat.

TVS MOTOR COMPANY LIMITED

Registered Office: "Chaitanya" No. 12, Khader Nawaz Khan Road, Nungambakkam, Chennai - 600006 CIN: L35921TN1992PLC022845 Website: tvsmotor.com

Email: contactus@tvsmotor.com Ph.: 044-28332115

NOTICE OF LOSS OF SHARE CERTIFICATES NOTICE is hereby given that the following share certificate(s) issued by the company are stated to have been lost or misplaced or stolen and the registered holders/ the legal heirs of the registered holders thereof have applied to the company for issue of duplicate share certificate(s)

Folio No.	Share Cert. No.	No. of Share	Distinctive Nos.	Name of registered holder
V05711	1356 19905	500 500	1250181-1250680 242506984-242507483	Vijay Somabhai Patel Somabhai Narandas Patel

The public are hereby warned against purchasing or dealing in any way, with the above share certificates. Any person(s) who has/have any claim(s) in respect of the said share certificates should lodge such claim(s) with the company at its registered office at the address given above within 15 days of publication of this notice, after which no claim will be entertained and the company will proceed to issue dunlicate share certificates For, TVS Motor Company Limited K.S. Srinivasan Place: Chennai Date: 05-05-2023 **Company Secretary**

GYSCOAL ALLOYS LIMITED

Registered Off.: Plot No. 2/3, GIDC, Ubkhal, Kukarwada, Tal. Vijapur, Dist. Mehsana - 382830 Gujarat. Corporate Office: 2nd Floor, Mrudul Tower, B/h. Times of India, Ashram Road.

Ahmedabad - 380009 || Tel. : 079- 66614508 || Website : www.gyscoal.co E- Mail : cs@gyscoal.com || CIN : L27209GJ1999PLC036656

CORRIGENDUM ADDENDUM TO THE NOTICE CONVENING THE EXTRA ORDINARY GENARAL MEETING TO BE HELD ON 12/05/2023

This is with reference to the Notice dated 10-04-2023 for the Extra-Ordinary Genera Meeting and e-voting to be Held on Friday, May 12, 2023, read with earlier newspaper published on 20/04/2023 in Financial Express (English & Gujarati edition), we hereby wish to bring your kind attention to the following further explanation by way of this corrigendum (addendum) to the following explanatory statement for item no 4, 5 & 6 to the EOGM notice as mention herein above:

the EOGM notice as mention herein above:

1. Modification to the item no. 6 heading - "Issue Pricing" (after re-computation as per regulation 164, 166A of SEBI (ICDR) Regulation, 2018):

The issue price of the Preferential Issue and Allotment Of 12,70,00,000 Equity Shares shall be at an Issue Price Of Rs. 3.24 (Rs. 1/- Face Value + Rs. 2.24/- Premium Per Share] To Mona Viral Shah - Promoter (By Way Of Conversion Of Loan Into Equity Shares) And Non-Promoters Respectively and Issue Of 2,40,00,000 Convertible Warrants Into Equity Shares shall be at an Issue Price Of Rs. 3.24 (Rs. 1/- Face Value + Rs. 2.24/- Premium Per Share] To Mona Viral Shah - Promoter By Way Of Conversion Of Loan Into Equity Shares. Sharej to Mona Viral Shan - Promoter By Way Of Conversion Of Loan Into Equity Shares. Further, in Item No. 5, 6 & their respective notes Issue Price shall be read as Rs. 3.24 (after re computation as per regulation 164, 166A of SEBI (ICDR) Regulation, 2018) instead of Rs. 3.10 wherever it is mentioned in the Notice. Please note that Mona Shah, promoter & director has participated in the present preferential issue by way of conversion of her outstanding loan to company into equity shares and convertible warrants. So the outstanding loan mount to be adjusted as mentioned in the notice shall be modified with the issue price i.e. from Rs.3.10 to Rs.3.244-.

2. Modification to the item no 4 to the explanatory statement - "RE-CLASSIFICATION OF PROMOTER & PROMOTER(S) GROUP TO PUBLIC CATEGOTY" (There was a typographical error in the explanatory statement to the item no-4 heading Confirmation by the Outgoing Promoters": the line be and hereby now read as

The Outgoing Promoters in their respective request letter in mail have not confirmed that, they along with the persons related to them."
Further, the Outgoing Promoters have not confirmed that subsequent to their eclassification, they shall continue to comply with the provisions of Regulation 31/

(4) of the Listing Regulations." This corrigendum to the Notice convening the EOGM to be held on 12-05-2023 shal form an integral part of the EOGM Notice date. Accordingly all the concerned members stock exchanges, depositories, registrar, transfer agent and all stakeholders are equested to take note of revision / modification.

This corrigendum is available on the website of the company at www.gyscoal.con and is being communicated to stock exchange i.e. BSE Limited and National Stock Exchange of India Limited where the shares are listed.

For, Gyscoal Alloys Limited sd/- Hiral Patel, Company Secretary Date: May 05, 2023 Place: Ahmedabad

प्राचाव नैश्नानल बैंक **७** punjab national bank

Circle Office, Vadodara Stock Exchange Building, Ground Floor, Fortune Tower, Sayajigunj Vadodara. E-Mail covadgad@pnb.co.in Phone-0265-2361734

PREMISES REQUIRED FOR ATMS Punjab National Bank requires suitable ready built and well-constructed Room/Shop type premises having Carpet Area of 80-100 sq. ft. on lease /rental

asis. I remises should be preferably on around 1 loor as per following.				
Sr.	Identified Locations	Carpet Area Requirement		
1.	Manujusar GIDC (Savli)			
2.	Limbdi Market (Dahod)			
3.	Dediapada			
4.	Main Market- Umreth	80 - 100		
5.	College Road- Nadiad	Sq. Ft.		
6.	Market Char Rasta- Dabhoi	·		
7.	Railway Station Area- Ankleshwar			
8.	Railway Station Area- Bharuch			
9.	Vadodara City- 2 Locations			

10. Garudeshwar (Narmada) The premises should be commercial approved or a building conforming to the conditions stipulated by concerned Government authority for commercial use and should have all clearance certificates from statutory authorities. Interested owners/ registered Power of attorney Holders of such premises in the desired locality who are ready to lease out their readily available premises on long term lease basis preferably for 15 years or more may send their offers in the prescribed format available on Bank's Web Site www.pnbindia.in or the same may be obtained from the above address during office hours. The complete offer duly sealed & signed should reach the undersigned on or before 19.05.2023 up to 05.00 PM at the above address. No brokerage will be paid by the Bank. Bank reserves the right to accept or reject any or all offers at its sole discretion without assigning any reasons whatsoever.

Date: 06/05/2023, Place: Vadodara

UCO Bank, Athwalines Ground Floor Narmada यूको बैंक 🙀 uco ванк Appartment, Opp. Ambika Niketan, Parle Point, Surat -395007, Email : athwal@ucobank.co.in

POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorised Officer of the UCO BANK under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of ecurity Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act" and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002, issued a Demand Notice dated 09.01.2023 and calling upon the Borrower(s) Mr. Malviya Dhirubhai Veljibhai And Mrs. Malviya Bhavanaben Dhirubhai, to repay the amount mentioned in the notice, being Rs.39,80,452.72 (Rupees Thirty-Nine Lakhs Eighty Thousand Four Hundred Fifty-Two And Seventy-Two Paisa Only) as on Date of 29/12/2022 (Inclusive Of Interest Up To 31/08/2022) and excluding future interest, legal charges, other costs & incidental charges thereon, within 60 days rom the date of receipt of the said notice.

The borrower/ Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken ossession of the property described herein below in exercise of powers conferred on him under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 4th Day of May of The Year 2023.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the harge of UCO Bank for an amount of Rs.39,80,452.72 (Rupees Thirty-Nine Lakhs Eighty Thousand Four Hundred Fifty-Two and Seventy-Two Paisa Only)

he borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

All The Right, Title and Interest in Immovable Property Bearing Plot No.174 (As Per KJP Block No. 554/174) Adm. 72.00 Sq. Mts. In Patel Nagar Society, Near Wisdom International School, Kamrej, Surat Wah All the Appurtenances Pertaining Thereto, Standing on Land Bearing R.S. No 608/2 Paiki And 609, Block No. 554/B, Being and situated At. Village: Kamrej, District Surat, Sub Dist.: Kamrej in The Name of Mr. Dhirubhai Velajibhai Malviya. Bounded By : East : Society Road, North : Plot No -175, West: Plot No -149, South: Society Road

Authorized Officer Date : 04.05.2023 | Place : Surat

South - Road

HERO HOUSING FINANCE LIMITED

stered Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New De Branch Office: 309, Third Floor, Nishal Centre, Near Nishal Circle, Pal Road, Pal.Adaian, Surat - 395009.

PUBLIC NOTICE (E- AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTY) (UNDER RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 20021 Notice For Sale Of Immovable Property Mortgaged With Hero Housing Finance secured Creditor) Under The Securitisation And Reconstruction Of Financial Assets An Inforcement Of Security Interest Act 2002

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) o their legal heirs/ representatives that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 13-Jun-2023 (E-Auction Date) on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co- Borrowers or Guarantors. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. The EMD should be made through Demand Draft/RTGS/NEFT for participating in the Public E-Auction along with the Bid Form which shall be submitted to the Authorised Officer of the Hero Housing Finance Ltd On or before 12-Jun-2023 till 5 PM at Branch Office: Office No. 309, Third Floor, Nishal Centre, Near Nishal Circle, Pal Roac

	•						
an	Name of Borrower(s)/ Co-	Date of		Reserve Price			
count	Borrower(s)/ Guarantor(s)/	Demand Notice	(Under Constructive/	Earnest			
).	Legal Heir(s)/ Legal Rep.	Amount as on date	Physical)	Money			
IFRAJ	SIDAPARA ATULBHAI	15/07/2021	Dhysical	Rs.			
DU1900	RATNABHAI, SIDPARA	Rs. 32,90,910/-		10,00,000/-			
02005	ASMITABEN ATULBHAI	as on 04/05/2023	Possession	Rs.1,00,000/-			
scription of Property: All The Piece And Parcel Of The Property Rearing Maydi. City Survey							

No. 656, Old Gelaai Mataji Mandir Street, Mavdi, Rajkot, Gujrat – 36005 (having Area Of Plot As Pe Sale Deed 501 Sq. Feet.). Bounded by: East - C.S. no. 654, West – C.S. 657, North – C.S. no. 659,

Terms and condition: The E-auction will take place through portal https://sarfaesi.auctiontiger.ne on 13-Jun-2023 (E-Auction Date) between 2.00 PM to 3.00 PM with limited extension of 1d minutes each.1)The prescribed Tender/ Bid Form and the terms and conditions of sale will be available with the Branch Office: 309.Third Floor , Nishal Centre, Near Nishal Circle, Pal Road Pal, Adajan, Surat - 395009.. between 10.00 a.m. to 5.00 p.m. on any working day. 2) mmoyable property shall not be sold below the Reserve Price, 3)Bid increment amount shall be Rs. 10,000/- (Rupees Ten Thousand Only). 4)All the bids/ tenders submitted for the purchase of the above property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft/RTGS/NEFT favouring the "HERO HOUSING FINANCE LTD." The EMD amount will be return to the unsuccessful bidder after conclusion of the E-auction. 5)The highest bidder shall be declared as successful bidder provided always that he/she is legally qualified to bid and provided further that the bid amount is not less than the reserve price. It shall be the discretion of the Authorised Officer to decline/ acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. 6)The prospective bidders can inspect the property on 06-Jun-2023 between 11.00 A.M and 2.00 P.M with prior appointment. 7) The person declared as a successful bidder shall, immediately after the declaration, deposit 25% of the amount of purchase money highest bid which would include EMD amount to the Authorised Officer within 24 Hrs. and in default o such deposit, the property shall forthwith be put to fresh auction/ sale by private treaty. 8\ln. case, the such deposit, the property shall not within be put to the shadout of sale by private really. 6)III case in Initial deposit is made as above, the balance amount of the purchaser money payable shall be paid by the purchaser to the Authorised Officer on or before the 15th day from the date of confirmation o he sale of the property, exclusive of such day or if the 15th day be a Sunday or other holiday, then or the first office day after the 15th day. 9In the event of default of any payment within the perior mentioned above, the property shall be put to fresh auction/ sale by private treaty. The deposit ncluding EMD shall stand forfeited by Hero Housing Finance Ltd. and the defaulting purchaser shall ose all claims to the property. 10)The above sale shall be subject to the final approval of Herr Housing Finance Ltd. 11)Details of any encumbrances, known to the HERO HOUSING FINANCE LTD, to which the property is liable: Not Known. Claims, if any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value: Not Known. 12)Interested parties are requested to verify/confirm the statutory and other dues like Sales/Property tax, Electricity dues, and society dues, from the respective departments / offices. The Company does no undertake any responsibility of payment of any dues on the property. 13)TDS of 1%, if any, shall be payable by the highest bidder over the highest declared bid amount. The payment needs to be leposited by the highest bidder in the PAN of the company and the copy of the challan shall be submitted to the company. 14) Sale is strictly subject to the terms and conditions incorporated in this advertisement and in to the prescribed tender form. 15)The successful bidder/purchaser shall bear all stamp duty, registration fees, and incidental expenses for getting sale certificate registered as applicable as per law. 16)The Authorised Officer has the absolute right to accept or reject the bid or adjourn / postpone / cancel the tender without assigning any reason thereof and also to modify any terms and conditions of this sale without any prior notice. 17)Interested bidders may contact Mr. Raj Mishra at Mob. No. 9971808985 during office hours (10.00AM to 6.00 PM) or mail on

30 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR

The above mentioned Borrower/Mortgagor/guarantors are hereby noticed to pay the sum as mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be

assetdisposal@herohfl.com by mentioning the account no. of property/borrower. 18)For any othe

details or for procedure online training on e-auction the prospective hidders may contact the Service

Provider, M/s e-Procurement Technologies Limited (Auctiontiger), Emai

vered with interest and conditions of the sale, please refer to the link provided it https://uat.herohomefinance.in/hero housing/other-notice on Hero Housing Finance Limited

Authorised officer, Mr. Dhirendra Singh, Mob- 9587033317 Email;assetdisposal@herohfl.com

STAR MEGA E-AUCTION

Bank of India BOI Relationship beyond banking

ASSET RECOVERY DEPARTMENT

FOR SALE OF PROPERTIES 6TH FLOOR, BANK OF INDIA BUILDING, BHADRA, AHMEDABAD. PHONE: 079 - 66122528, 66122530 SALE NOTICE FOR SALE OF MOVABLE & IMMOVABLE PROPERTIES

TIME OF E-AUCTION: 25.05.2023, 12:00 NOON TO 04.00 PM WITH AUTO EXTENSION CLAUSE INCASE OF BID IN LAST 10 MINUTES BEFORE CLOSING E-AUCTION SALE NOTICE FOR SALE OF MOVABLE & IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT **DATE AND TIME OF E-AUCTION: 25.05**

olus applicable charges and interest thereon.

OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISO TO RULE 8(6) & 6(2), 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described (Movable & Immovable Property/ies) mortgaged/hypothecated/pledged/charged to the bank of India. The constructive / physical possession of which has been taken by the Authorized Officer of Bank of India

(Secured Creditor), will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis on 25.05.2023.

DESCRIPTION OF THE MOVABLE & IMMOVABLE PROPERTIES WITH KNOWN ENCUMBRANCES IF ANY

	Sr. Name of Borrower / Guarantor & Address & Name of the Branch No. & Outstanding Dues	Description of Properties	Reserve Price	EMD Price			
	To repay the amount mentioned in the notices being, Rs. 15,08,912/- and further interest & expenses thereon. Authorised Officer: Mrs. Dipti Jain, Mob.: 8950268494 Himmatlal Park Branch, Ahmedabad	All piece and parcel of the immovable property being Flat no C/504, on 5th floor, (as per raja chitthi Forth Floor), admeasuring 75.00 square meters built up area, together with right to use common area passage, amenities, and facilities alongwith proportinoate undivided ownership rights, tittle and interest in land admeasuring 33.04 Sq.Meters in the scheme of "Millenium Hights" constructed on non agriculture land bearing mouje chiloda, (Naroda) Sim survey No. 57/5, admeasuring 3339 Sq.Meteres, Town Planing Scheme No. 99 (Chiloda-Naroda) Final Plot No. 12, admeasuring 2004 Sq.Mtrs. situated lying being at mouje chiloda(Naroda) Taluka Asarwa in the registration district and sub district ahmedabad-6(Naroda), bounded as:, East: Flat no C-503, West: Scheme Common Road, North: Common Margin, South: Stairs, Foyer. Cersai Assets ID: 200030228119 (Property is under Physical Possession)		Rs. 1,90,600/-			
ΙL	Inspection Date & Time of properties : 12.05.2023 during 12.00 Noon to 04.00 PM.	Remaining Amount of Sale to be deposited: RTGS / NEFT/Fund Transfer to credit of A/c No. 20369020000033, Bank of India, Himmatlal Park Branch, Ahmeda	bad, IFSC Code :	BKID0002036			
	Ir. Prakashbhai Bhanjibhai Gohel or repay the amount mentioned in the notices being, Rs. 11,32,136.40/- and further interest & expenses thereon. uthorised Officer: Shri Pankaj Jaiswal, Mob.: 8953731621, huma Branch, Ahmedabad. Pratikkumar Parmar, Mo. 9033380141 All that part and parcel of the property situated of Mr. Prakashbhai Bhanjibhai Gohel of unit No B1-203 on the second floor having 33.57 Sq carpet area along with 31.45 undivided interest in land etc in scheme known as Umang Aditya being non agricultural freehold land, situate lying and being at Mouje Lambha, Block No 644 and 646, Final Plot No 293 of Town Planning Scheme No 19, Ta Vatva(City/city East) in the registration District Ahmedabad Sub- District Ahmedabad-11(Aslali) being a free hold property with a right to use and occupy the same and common amenties and boundary of the property situated of Mr. Prakashbhai Bhanjibhai Gohel of unit No B1-203 on the second floor having 33.57 Sq carpet area along with 31.45 undivided interest in land etc in scheme known as Umang Aditya being non agricultural freehold land, situate lying and being at Mouje Lambha, Block No 644 and 646, Final Plot No 293 of Town Planning Scheme No 19, Ta Vatva(City/city East) in the registration District Ahmedabad Sub- District Ahmedabad-11(Aslali) being a free hold property with a right to use and occupy the same and common amenties and boundary in the registration District Ahmedabad Sub- District Ahmedabad-11(Aslali) being a free hold property with a right to use and occupy the same and common amenties and boundary in the registration District Ahmedabad Sub- District Ahmedabad-11(Aslali) being a free hold property sunder Physical Possession)		Rs. 10,85,416/-	Rs. 1,08,542/-			
Ш	Inspection Date & Time of properties : 12.05.2023 during 12.00 Noon to 04.00 PM.	Remaining Amount of Sale to be deposited: RTGS / NEFT / Fund Transfer to Credit of A/c No. 20569020000033, Bank of India, Ghuma Branch, Ahmedabad. IFSC Code: BKI	(ID0002056				
	To repay the amount mentioned in the notices being Rs. 14,48,275 /- and further interest & expenses thereon.	Lot No. 1: - All the part and parcel of the property being flat No. D-104(First Floor) admeasuring 80 Sq. Yards i.e. 66.88 Sq. Mtrs Super Built Up Area together with right to use common areas passage amenties and facilities alone with proporpionated undevided ownership right title and interest inthe scheme "Aman city" constructed on Non agricultural land bearing Survey No. 731 allotted draft Town Planning Scheme No. 85, Final Plot No. 75 situate, being and lying at Mouje Vatva, Taluka City in the Registration District Ahmedabad Bounded By: East: Flat Nol. D-101. West: Common Wall, North Flat No. D-105, South: Flat No. D-103 (Property is under Physical Possession)	Rs. 12,70,000/-	Rs. 1,27,000/-			
Ш	Inspection Date & Time of properties : 12.05.2023 during 12.00 Noon to 04.00 PM.	Remaining Amount of Sale to be deposited: RTGS / NEFT / Fund Transfer to Credit of A/c No. 20129020000033, Bank of India, Narol Branch, Ahmedabad. IF	SC Code : BKID0	002012			
	To repay the amount mentioned in the notices being Rs. 59.34.581.40/-, and further interest & expenses thereon	All that piece and parcel of immovable property being Plot No. 36 Shrey Industrial Park, After Divine Industrial Park Moje - Dhamatvan Taluka Daskroi Dist. Ahmedabad - 382430 having Plot Area Admeasuring 566.50 Sq.Mtrs. or 677.53 Sq. Yds. in the name of Mr. Sanvria Rameshwarlal Sukhwal. Bounded: East: 9.00 Mt. Internal Road, North: Plot No. 37, West: Plot No. 31, South: Plot No. 35. (Property is under Symbolic Possession)	Rs. 1,01,94,000/-	Rs. 10,19,400/-			
Ш	Inspection Date & Time of properties : 12.05.2023 during 12.00 Noon to 04.00 PM.	Remaining Amount of Sale to be deposited: RTGS / NEFT / Fund Transfer to Credit of A/c No. 20089020000033, Bank of India, Maninagar Branch, Ahmedal	bad. IFSC Code :	BKID0002008			
		Lot No. 1 :-Equatable Mortgate of residential property situated at O/301, Aditya Apartment, India Colony, Mehemdabad Road, Hathijan, Ahmedabad 382445 admeasuring super builtup area 129.99 Sq. Yard. (Property is under Physical Possession)	Rs. 19,02,000/-	Rs. 1,90,200/-			
	Inspection Date & Time of properties : 12.05.2023 during 12.00 Noon to 04.00 PM.	Remaining Amount of Sale to be deposited : RTGS / NEFT/Fund Transfer to credit of A/c No. 20419020000033, Bank of India, Sarkhej Road Branch, Ahmedabad, IF	SC Code : BKID00	02041			
	To repay the amount mentioned in the notices being Rs. 13,54,220.73/- and further interest & expenses thereon. Authorised Officer: Shri A.K.Makwana, Mob.: 7203040720	All that part and parcel of the property consisting of Flat No. B/301 3rd Floor of Sangani Platinum, Opp. Satva-2 Narol Aslali Road, Ahmedabad - 382405 Final Plot No. 56/2 + 57 + 58/1 in Survey No. 575, 576, 579, T.P.S. No. 58 situated at Mouje Vatva, Taluka City Vatva, District Sub Registrar Aslali, Ahmedabad. Bounded: On the North by: Scheme Road, On the South by: Passage and Flat No. B/302, On the East by: Stair Case, On the West by: Scheme Margin. (Property is under Symbolic Possession)	Rs. 19,05,000/-	Rs. 1,90,500/-			
L	1,1111111111111111111111111111111111111	Remaining Amount of Sale to be deposited: RTGS / NEFT/Fund Transfer to credit of A/c No. 200790200000033, Bank of India, Manek Chowk Branch, Ahmedabad, I	FSC Code : BKIDO	002007			
TE	DMC & CONDITIONS .						

FERMS & CONDITIONS :-

(1) The auction/bidding will be done "On Line e-Auctioning" through website: https://ibapi.in on the time & date mentioned above against secured assets. (2) Before submitting bid, Earnest Money Deposit (EMD) shall be deposited through NEFT/Fund Transfer in working hours before Commencement of Bidding. Intending Bidders are advised to go through the website of the e-auction service providers - https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp For downloading further details, Process Compliance and Terms & Conditions, Please visit :- Bidder may visit, https://www.ibapi.in

where "Guidelines" for bidders are available with educational videos. Bidders have to complete following formalities well in Advance:-Step 1:- Bidder/Purchaser Registration: Bidder to register on e-Auction Platform (link given above) using his mobile number and email-id

Step 2 :- KYC Verification :- Bidder to upload requisite KYC documents. KYC documents shall be verified by e-auction service provider (may take 2 working days).

Step 3:- Transfer of EMD amount to Bidder Global EMD Wallet: Online/off-line transfer of fund using NEFT/Transfer, using challan generated on e-Auction Platform.

Step 4: - Bidding Process and Auction Results: Interested Registered bidders can bid online on e-Auction Platform after completing Step 1, 2 and 3. Please note that Step 1 to Step 3 should be completed by bidder well in advance, before e-Auction.

(3) The Offer without EMD or proper documents submission will summarily be rejected. The bidder whose bid will be found highest at the close of the e-auction process shall be declared as successful bidder and a communication to this effect will be issued through electronic mode which shall be subject to the approval by the Authorised Officer of the Bank. The successful bidder shall deposit 25% of the sale price immediately (including the EMD already paid), Balance amount of the sale price has to be deposited within 15 days from the date of confirmation of sale, failing which the Bank shall forfeit the amount already paid/deposited by the purchaser (including EMD) In default of payment property/ies shall be borne by the buyer. (4) Incase sale s not confirmed or set aside on any ground whatsoever, the bidder shall bear all the incidental expenses, if any to the sale and purchaser/bidder shall not be entitled to claim any compensation or damages whatsoever. (5) In case of a single bidder who paid the EMD but not participated in the e-auction will be considered as successful bidder for the minimum reserve price by the Bank. (6) The interested parties/intending bidder may contact for further details to The Authorised Officer, Bank of India. (7) The decision of the Bank/authorized officer regarding sale of property shall be final, binding and unquestionable. The bank reserves its right to cancel/postpone the sale without assigning any reasons. (8) On Payment of entire sale price and completion of sale formalities a sale certificate (as per format prescribed in the SARFAESI Rule) will be issued to the successful purchaser/bidder. The successful purchasers shall bear all existing/future taxes, stamp duty, registration fee, incidental expenses etc. for getting the sale certificate registration. (9) This notice is also a notice to the above borrowers/mortgagors/guarantors under Rule 8(6) of the Security Interest (Enforcement) Rules-2002. (10) The bidders may participate in E-auction for bidding from their place of choice. Internet connectivity shall have to be ensured by bidder himself, Bank/Service provider shall not be held responsible for the internet connectivity, network problems, system crash down, power failure etc. (11) EMD of the unsuccessful bidder will be returned on 3rd day of the closure of E-auction sale proceedings, No interest shall be paid on the EMD refunded to the unsuccessful bidders. (12) The intending bidders should make discreet inquires as regards any claim, charge and encumbrances on the property any authority besides the Banks charges and should satisfy themselves about the title, extent, quality and quantity of the property before submitting their bid. (13) If the borrower pays the amount dues to the banks in full before the date of sale, auction liable to be stopped/canceled/withdrawn. (14) The sale shall be subject to the conditions prescribed in the security interest Enforcement) Rules-2002 and the guidelines of the Banks in pursuance of the instructions of Govt. of India in this regard. (15) Priority will be given to offer of Composite Lot and bid for Plant and Machinery will be considered for sale only if no bid is received for Land and Building. (16) The bid price shall be above the reserve price and bidder shall improve their future offer in multiple of Rs. 10,000/-. (17) The buyer shall bear the TDS wherever applicable including other statuary dues, registration charges, stamp duty, etc. (18) In case of any discrepancy between the English version & vernacular language version, the English version will be preferred.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT - 2002

The borrower / guarantors are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of e-Auction, failing which the property will be auctioned / sold and balance dues, if any, will be recovered with interest and cost. Date: 06.05.2023, Place: Ahmedabad Authorised Officer, Bank of India

















વૈશ્વિક તેજીથી સોના-ચાંદીમાં એકધારો ભાવ વધારો

सोनुं ६४००० કुहावी पाछ इयुः याही ८०,००० नी नश्च इ

સોના-ચાંદીમાં વિક્રમી-બેફામ તેજીનો દોર અટકવાનું નામ લેતો ન હોય તેમ આજે વધ્ ઉછાળો નોંધાયો હતો.ચાંદી ૮૦,૦૦૦ ની નજીક પહોંચી ગઈ છે. જયારે સોનું ૬૪૦૦૦ કુદાવીને પાછુ ફર્યુ હતું.

ઝવેરીઓના કહેવા પ્રમાણે વૈશ્વીક માર્કેટની જોરે ગઈરાત્રે જ સોના-ચાંદીના ભાવો કરી સળગી ગયા હતા અને આજે પણ તેજી જારી રહી હતી.હાજર ચાંદી ૮૦,૦૦૦ ની નજીક પહોચી હોય તેમ ઉંચામાં ભાવ ૭૯,૬૦૦ થયા બાદ ૭૯.૨૦૦ સાંપડયા હતા.

કોમોડીટી એકસચેંજમાં ભાવ ૭૮૨૮૦ થયો હતો. વિશ્વ બજારમાં ભાવ ૨૬ ડોલરને આંબી ગયા બાદ ૨૫.૯૦ ડોલર હતો બીજી તરફ સોનું પણ ૬૪૦૦૦ ને ક્રોસ કરીને પાછ આવ્યું હતું. ઉંચામાં ૬૪૧૦૦ થયા બાદ ૬૩૫૫૦ સાંપડયુ હતું.

વિશ્વબજારમાં ૨૦૫૯ ડોલર થઈને ૨૦૪૦ ડોલર હતું.કોમોડીટી



વિશ્વસ્તરે અનેક ભાગોમાં ભૌગોલીક ટેન્શન, વિવિધ દેશોની બેંકો

ચાલુ વર્ષમાં જ સોનુ ૬૮૦૦૦ તથા ચાંદી ૯૫૦૦૦ ને આંબી જવાની નિષ્ણાંતોની આગાહીઃ નબળા ડોલર તથા આર્થિક મંદીની તીવ્ર અસર

દ્વારા સોનાની સતત ખરીદી અમેરીકાએ ફરી વ્યાજદર વધારતા વિવિધ

કરન્સી સામે નબળા પડતાં ડોલર જેવા કારણોથી સૌથી સુરક્ષીત એસેટ કલાસ ગણાતા સોના-ચાંદીમાં રોકાણ સતત વધી રહ્યું છે.

જાણકારોએ કહ્યું કે અમેરીકી ફેડરલ રીઝર્વે હવે વધુ વ્યાજદર વધારો નહિં કરવાનું જાહેર કર્યુ હોવા છતાં સોના-ચાંદીની તેજી આગળ ધપતી રહ્યાનું સુચક છે. ઈન્ડીયન બુલીયન જવેલર્સ એસો.નાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે ભલે અમેરીકાએ વ્યાજ નહિ વધારવાનું જાહેર કર્યું હોય પરંતુ ફેડરલ રીઝર્વનાં સ્ટેટમેન્ટમાં બેંકીંગ કટોકટી વિશે ચિંતા દર્શાવવામાં આવી હોવાથી સોના-ચાંદીમાં તેજીનો

માહોલ યથાવત રહ્યો હતો.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આવતા મહિનાઓમાં સોનાનો ભાવ ૬૬૦૦૦ થી ૬૮૦૦૦ થઈ શકે છે. ડોલર અને બોન્ડ પીલ્ડ દબાણ હેઠળ છે. તેનો સીધો પ્રત્યાઘાત પડી શકે છે. આર્થિક મંદીનાં જોખમની પણ અસર છે.ચાંદીનો ભાવ ૯૫૦૦૦ સુધી પહોંચી શકે છે.

બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુધ્ધના જન્મ દિવસ બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉત્તરપ્રદેશના વારાણસીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ પવિત્ર ગંગા નદીમાં પૂષ્યની ડૂબકી મારી સ્નાન કરી રહ્યા છે.

પેટ્રોલ-ડિઝલ જેવો ઘટનાક્રમ ખાદ્યતેલોમાં...

વિશ્વબજારમાં ખાદ્યતેલોમાં મોટી મંદી; ભારતમાં કંપનીઓ ભાવ ઘટાડતી નથી

કરાેડ ના ખાદ્યતે લની

ખોકટો બર)માં **કંપનીઓને તાત્કાલિક** અ માટ તમામ થાડા સમય લાગશ. દુક સમયમાં ઓકટો બર)માં **કંપનીઓને તાત્કાલિક** પક્ષકારોએચર્ચાકરી ખાદ્યતેલના રિટેલ ભાવ ઘટવાનો રૂા.૧.૫૭ લાખ **ભાવ ઘટાડવા સરકારની** હતી. 'ઘારા' અંદાજ છે.' ખાઘતેલનું વેચાણ તાકીદ કરતી મધર ડેરીએ

આયાત કરી હતી. છેહ્વા કેટલાક ગુરુવારે ભાવમાં પ્રતિ લિટર રૂા.૧૫-મહિનામાં તેલના ભાવ ઘણા ઉંચા ૨૦ ઘટાડવાની જાહેરાત કરી હતી. રહ્યા હોવાથી સરકારે હવે ઘટેલા નવો સ્ટોક આગામી સપ્તાહે બજારમાં ભાવનો લાભ ગ્રાહકોને આપવા આવશે. સરકારી ડેટા મુજબ ગુરુવારે જણાવ્યું છે.ભારત મલેશિયા અને પેકેજડ સીંગતેલનો રિટેલ ભાવ પ્રતિ ઈન્ડોનેશિયા પાસેથી પામ ઓઈલ કિગ્રાગ્રા.૧૮૯.૧૩, વનસ્પતિ ઘીનો ખરીદે છે. જયારે આર્જેન્ટીના અને ભાવ પ્રતિ કિગ્રા રૂા.૧૩૨.૬૨, બ્રાઝીલથી સોયાબીન તેલની આયાત સો યાબીન ઓ ઈલનો ભાવ કરવામાં આવે છે. ખાદ્ય સચિવ સંજીવ રૂા.૧૩૮.૨૦, સનફલાવર તેલનો ચોપરાએ ખાદ્ય તેલ ઉદ્યોગના ભાવ પ્રતિ કિગ્રા રૂા.૧૪૫.૧૮ અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં જણાવ્યું પામ ઓઈલનો ભાવ રૂા.૧૧૦.૦૫ હતું કે, 'ખાદ્ય તેલોના ભાવમાં હતો. ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઘટાડાનો લાભ શકય એટલી ઝડપથી છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ગ્રાહકોને આપવો જોઈએ.' સોલ્વન્ટ ભાવ ઘટાડા તરફી છે, જે ભારતના એકસ્ટ્રેશન એસોસીએશન ઓફ ખાદ્યતેલક્ષેત્રમાટે સાનુકૂળ સમાચાર ઈન્ડીયા (એસઈએ) અને ઈન્ડીયન છે. નિવેદનમાં જણાવ્યા અનસાર

અદાણી આંધ્રપ્રદેશમાં ડેટા સેન્ટર અને ટેકનોલોજી બિઝનેસ પાર્કનું નિર્માણ કરશે

અદાશી ગ્રુપ પ્રદેશમાં સ્થાનિક ટેકનોલોજી ઈકોસિસ્ટમને વેગ આપવા માટે વિઝાગમાં ઈન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર એન્ડ ટેકનોલોજી બિઝનેસ પાર્ક વિકસાવી રહૃાું છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એસ. જગમોહન રેકી અદાણી સમૂહના મેનેજિંગ ડિરેકટર રાજેશ અદાશી અને અદાશી પોર્ટસના સી.ઈ.ઓ. અને પૂર્શકાલિન ડાયરેકુટરની ઉપસ્થિતિમાં તા. ૩જી મેએ વિઝાગમાં પાર્ક સાઈટ પાર્કમાં ૩૦૦ પર ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ યોજાયો હતો.

મેગાવોટની સંકલિત डेटा सेन्टर सुविधानुं अने भिजनेस पार्ड तेमक આયોજન કરશે

ડેટા સેન્ટર, ટેકનોલોજી કૌશવ્ય વિકાસ કેન્દ્ર ધરાવનારા આ પ્રોજેકટ સ્થાનિક સમુદાયો

માટે નોકરીઓનું સર્જન કરવા સાથે વિઝાગને એશિયા પેસિફિક આઈટી ઈકોસિસ્ટમ સાથે જોડતાં આ પ્રદેશમાં વિકાસની નવી

અદાશી કોનેક્સએ અદાશી ગ્રુપ અને એડજ કોનીક્સ વચ્ચે ૫૦-૫૦નું સંયુક્ત સાહસ છે. જે પાર્કમાં ૩૦૦ મેગાવોટની સંકલિત ડેટા સેન્ટર સુવિધાનું આયોજન કરશે. આ પાર્ક સંપૂર્ણ રીતે રિન્યુએબલ એનર્જીથી સંચાલિત હશે અને પ્રદેશમાં ક્લાઉડ અને ઉભરતી ટેકનોલોજીને ખિલવવામાં મદદકરવા માટે મજબુત સબમરીન ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલ આ સંકલિત સુવિધા ભારતમાં સૌથી મોટા હાઈપરસ્કેલ ડેટા સેન્ટર પૈકીની એક હશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે વેજીટે બલ ઓઈલ પ્રોડયુસર્સ 'ઉદ્યોગ જગતે જણાવ્યું હતું કે, ખાદ્યતેલ કંપનીઓને વૈશ્વિક ભાવમાં એસોસીએશન (આઈવીપીએ) ના વિવિધ ખાદ્ય તેલના વૈશ્વિક ભાવમાં ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં પણ પ્રતિનિધિઓ બેઠકમાં હાજર હતા. બે મહિનાથી પ્રતિ ટન ૨૦૦-૨૫૦ તેલ સસ્તું કરવા જણાવ્યું છે. ભારતે વૈશ્વિક સ્તરે ખાદ્ય તેલના ભાવમાં ડોલરનો ઘટાડો નોંધાયો છે. જો કે, ૨૦૨૧ - ૨૨ના માર્કેટીંગ વર્ષ ઘટાડાનો લાભ ઘરઆંગણે મળી રહે સ્થાનિક બજારમાં તેની અસર થતા એ માટે તમામ થોડો સમય લાગશે. ટુંક સમયમાં

આથી જાહેર જનતાને જણાવવાનું કે, અમે મહેશ જસાણી ખુલાસો કરીએ છીએ કે અમારે વર્ષ ૨૦૧૫ તથા ૨૦૧૬ માં શ્રી બ્રિજેશકુમાર જયરામ નાથ સાથે શીપીંગ અને એક્ષ્યોર્ટ ના કામકાજ શરૂ કેટલાક વર્ષો થી અમારે શ્રી બ્રિજેશકુમાર જયરામ નાથ જેડે કોઇ સંપર્ક ન હોવાથી અમોએ ઉતાવળ માં ૨૦૨૧ માં પોલીસ ફરિયાદ કરેલ તથા ૧૬.૦૨.૨૦૨૨ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન માં એફ આઇ.આર કરેલ હતી. ત્યાર બાદ ૦૨.૦૬.૨૦૨૨ ના રોજ અમોએ પ્રતિષ્ઠિ માણસો સાથે બેસીને હિસાળ કરેલ અને તે પ્રમાણે અમોએ સમજુતી કરાર કરી દીધેલ છે. તે પ્રમાણે અમોએ શ્રી બ્રિજેશકુમાર જયરામ નાથ પાસેથી કોઈ લેહણું નીકળતું નથી.

અમોએ તેમની પ્રતિષ્ઠા ને ફરિયાદ કરીને ઠેસ પહોંચાડી છે તે બદલ અમો દિલગીર છીએ. અમો જાહેરમાં તેમની માફી માંગીએ છીએ. તેમની ખુબજ સારા, પ્રતિષ્ઠિત અને સન્માનીય વ્યક્તી છે અમારી ફરિયાદ થી તેમની છળી ને ઠેસ પહોંચી છે તે બદલ અમો ખુબજ દુખની લાગણી અનુભવિએ છીએ.

અમોએ પોલીસ ફરિયાદ હાઈકોર્ટ માંથી પાછી ખેચી લીધેલ છે. આ જાહેરાત નો હેતુ અમોએ કરેલ ફરિયાદ ને કારણ તેઓના માન, સન્માન, પ્રતિષ્ઠા તથા શાખ ને નુકસાન ન થાય તેના સ્પષ્ટીકરણ મહેશ જસાણી રેહ.: દ્ર-ચૈતન્ય નગર, અભિલાષા ટાવર સામે, લખુડી તળાવ પાસે,

નવરંગપુરા, ગુજરાત :-3૮૦૦૦૯. મો.નં.: ૯૮૨૫૪ ૩૧૨૫૪

🔰 pnb पंजाब नैशनल बैंक 🔰 punjobnotional bank સર્કલ SASTRA, છઠ્ઠા માળે, ગુજરાત ભવન, એમ.જે. લાયબ્રેરી પાસે, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬

परिशिष्ट-IV, [અंतर्गत नियम ८(९)] કબજા नोटीस (स्थायी मिलकत माटे) આથી निम्ननिर्धिष्ट **पंजाज नेशनव जेंड**, ना अधिङ्गत अधिङारीએ सरईसी એક્ટ–૨૦૦૨ હેઠળ સિક્થોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફ)ર્સમેન્ટ) રૂલ્સ–૨૦૦૨ ની સત્તાની રૂએ કલમ ૧૩(૧૨) સાથે વંચાતા રૂલ ૩, સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ २००२ हेठण ता. २४.०२.२०२३ ना रोष इरषहार/क्रमीनहार/गीरोहार श्री हर्शन ઈશ્વરલાલ ભાભા અને શ્રીમતી કોમલ દર્શન ભાભા (A/c. No. 519400NC00003230 અને 519400NC00003249) ને નોટીસમાં જણાવેલ રૂા. ૧૮,૪૬,૩૫૯.૮७ (અંકે રૂા. અઢાર લાખ છેંતાલીસ હજાર ત્રણસો ઓગણસાંઠ અને સીત્યાશી પૈસા પુરા) તા. ૨૪.૦૨.૨૦૨૩ સુધી, બાદ વસૂલાત જો હોય તો, સાથે સંપૂર્ણ ચૂક્વણી ન થાય ત્યાં સુધીનું આગળનું વ્યાજ, આકસ્મીક ખર્ચાઓ, કોસ્ટ, ચાર્જીસ વગેરે, આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસોમાં ચુકવવા માટે જણાવેલ હતું.

કરજદારો/જામીનદાર/ગીરોદાર રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરજદારો / જામીનદાર / ગીરોદાર અને આમજનતાને નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલ મિલકતનો તા ૦૪.૦૫.૨૦૨૩ ના રોજ કબજો લઈ લીધેલ છે.

આથી ખાસ કરીને કરજદારો/ગીરોદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકતનો સોદો કે વેચાણને લગતી કાર્યવાહી કરવી નહીં अने डोर्धपए। प्रકारनो व्यवहार डरेल हशे तो ते **पंजाल नेशनल जेंड नां ३१.** ૧૮,૪૬,૩૫૯.૮७ (અંકે રૂા. અઢાર લાખ છેંતાલીસ હજાર ત્રણસો ઓગણસાંઠ અને સીત્યાશી પૈસા પુરા) તા. ૨૪.૦૨.૨૦૨૩ સુધી સાથે સંપૂર્ણ ચૂક્વણી ન થાય ત્યાં સુધીનું આગળનું વ્યાજ અને ખર્ચાઓને આધિન રહેશે.

તારણમાં મુકેલ મિલકતને છોડાવવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈ અનુસાર કરજદારને આમંત્રિત કરવામાં આવે છે.

स्थायी भिलङतनुं वर्शन

(૧) શ્રી **દર્શન ઇશ્વરલાલ ભાભા**ની મિલકતનો તમામ ભાગ અને હીસ્સો, ફ્લેટ નં એ-૧/૫૪, પાંચમા માળે, (બ્લોક નં. એ-૧, ફ્લેટ નં. ૫૪) કાર્પેટ એરીયા આશરે દુ૪૫ ચો.કૂટ એટલે કે ૫૯.૯૨ ચો.મી. સાથે ૨૫.૧૫ ચો.મી. સ્કીમની અવિભાજીત જમીનનો સરખાભાગનો હીસ્સો, સાથે જનરલ સુવીધાના વપરાશ હક્ક, શાન-3 એન.એ. જમીન, સર્વે નં. ૧૪૧૦/૧ અને ૧૪૧૦/૨, ફાઈનલ પ્લોટ નં. ૩૨૭, ટી.પી સ્કીમ નં. ૧૨૮ મૌજે (સીમ) વટવા, તાલુકા: અમદાવાદ (શહેર-પૂર્વ), રજીસ્ટ્રેશન જીલ્લે અને પેટા–જીલ્લો અમદાવાદ–૧૧ (અસલાલી) હાઉસીંગ લોન નં 519400NC00003230 માં ગીરો મૂકેલ મિલકત. **ચતુર્સીમાઃ પૂર્વઃ** ફલેટ નં. એ-૨/૫૧, પશ્ચિમઃ ખુલ્લી જગ્યા, ઉત્તરઃ ફ્લેટ નં. એ-૧/૫૩, દક્ષિણઃ આંતરિક રોડ.

(૨) શ્રી દર્શન ઈશ્વરલાલ ભાભાની મિલકતનો તમામ ભાગ અને હીરસો, કલેટ નં એ-૧/૫૩, પાંચમા માળે, (બ્લોક નં. એ-૧, ફ્લેટ નં. ૫૩) કાર્પેટ એરીયા આશરે દુ૭૦ ચો.કૂટ એટલે કે દ્૨.૨૫ ચો.મી. સાથે ૨૫.૧૫ ચો.મી. સ્કીમની અવિભાજીત જમીનનો સરખાભાગનો હીસ્સો, સાથે જનરલ સુવીધાના વપરાશ હડક, શાન-3 એન.એ. જમીન, સર્વે નં. ૧૪૧૦/૧ અને ૧૪૧૦/૨, ફાઈનલ પ્લોટ નં. ૩૨૭, ટી.પી. સ્કીમ નં. ૧૨૮ મૌજે (સીમ) વટવા, તાલુકા: અમદાવાદ (શહેર-પૂર્વ), રજીસ્ટ્રેશન જીલ્લે અને પેટા-જીલ્લો અમદાવાદ-૧૧ (અસલાલી) હાઉસીંગ લોન નં. 519400NC00003249 માં ગીરો મૂકેલ મિલક્ત. **ચતુર્સીમાઃ પૂર્વઃ** ફ્લેટ નં. એ-૨/૫૨,

પશ્ચિમઃ ખુલ્લી જગ્યા, ઉત્તરઃ ખુલ્લી જગ્યા, દક્ષિણઃ ફ્લેટ નં. એ-૧/૫૪. તા. ૦૪.૦૫.૨૦૨૩, સ્થળઃ અમદાવાદ સહી/- અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક

સગીરોમાં સહમતીથી બંધાતા 'સંબંધો'માં પોકસો કાનૂન લાગુ કરી શકાય નહીઃ હાઈકોર્ટ મુંબઈઃ સગીર પરના દુષ્કર્મ સગીર છે તેને જેલમાં રાખવાથી

કે પછી જાતિય રીતે સતામણી તેનું ભવિષ્ય બગડી શકે છે અને માટેના કાનુન ધ પ્રોટેકન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ પ્રોફેન્સ એકટ-૨૦૧૨ રોમાન્ટીક બનેલા

વિશ્લેષણ કરતા મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું હતું કે **આ કાનૂન નથીઃ મુંબઈમાં** નહી. જો સગીરની સહમતીથી આ પ્રકારના સંબંધ 'પ્રેમી'ને જામીન

બને તો તેમા 'પોકસો' લાગુ કરી શકાય નહી. મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનુજા પ્રભુ દેસાઈએ સગીર સાથે જાતીય સંબંધના એક આરોપી જે છેલ્લા બે વર્ષથી જેલમાં હતો તેને જામીન આવતા ચૂકાદાએ જણાવ્યું કે પોકસો કાનૂન રોમાંટીક માટે પોકસો કાનૂન છે પણ જે કે સહમતીથી બનતા સંબંધોએ સામેલ સગીરોને સજા આપવા માટે નહી તે ફકત સગીરોને બળજબરીથી દૃષ્કર્મ અને જાતીય

સતામણી કરી બચાવવા અને તેના

આરોપીને ઉચીત દંડ- સજા કરવા

માટે જ ૨ વર્ષથી ખુંખાર કેદીઓ સાથે જેલમાં બંધ આરોપીને હજ્

ભવિષ્યમાં આ કેસ શરૂ થવાની સંભાવના પણ નથી તેથી આ રો પીને અચોકકસ સમય સગીરોને સજા આપવા સુધી જેલમાં રાખી શકાય

આ કેસમાં **ખે વર્ષથી જેલમાં બંધ** જે સગીરા હતી તેણે અદાલતમાં પણ સ્વીકાર્ય કે

તેની સહમતીથી આ સંબંધ બંધાયા હતા અને તેના પર કોઈ બળજબરી કે ધાક ધમકી થઈ નથી. હાઈકોર્ટે જણાવ્યું કે તેમાં કોઈ થોડા નથી કે સગીરાને દૃષ્કર્મ કે જાતીય અત્યાચારની વ્યવસ્થા

સંબંધ સહમતીથી અને રોમાંટીક રીતે બનતા હોય તો તેમાં સંબંધોમાં સામેલ સગીરોને સજા આપી શકાય નહી. આ કેસમાં સગીરાની સામે તેની પુત્રી પર દ્દષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપી પણ સગીર હતો અને તેના પરથી પોકસો કાનૂન લગાડયો હતો.

નામ બદલાવેલ છે અમે નીચે સહી કરનાર **નિનાદભાઇ**

જગદીશભાઇ દેસાઇ તથા કીરણબેન નિનાદભાઇ દેસાઇ આ સાથે જાહેર કરીએ છીએ કે અમે અમારા પુત્રનું નામ **રશીલ** નિનાદભાઇ દેસાઇ માંથી રશીલ નિનાદ દેસાઈ કરેલ છે. અને હવેથી અમારો પુત્ર રૂશીલ નિનાદ દેસાઇ તરીકે ઓળખાશે. - નિનાદભાઇ જગદીશભાઇ દેસાઇ (પિતા)

- કીરણબેન નિનાદભાઇ દેસાઇ (માતા) સરનામું : ઇ-૨૦૧, કોપર સ્ટોન એપાર્ટમેન્ટ, શ્રીધર બંગલાની બાજુમાં, થલતેજ - શિલજ રોડ, થલતેજ, અમદાવાદ - ૩૮૦ ૦૫૯ તારીખ : ૦૬/૦૫/૨૦૨૩, સ્થળ : અમદાવાદ

GYSCOAL ALLOYS LIMITED

Registered Off.: Plot No. 2/3, GIDC, Ubkhal, Kukarwada, Tal. Vijapur, Dist. Mehsana - 382830 Gujarat. 181. VIJāpur, Dist. менsana - 362650 Gujarat. **Corporate Office** : 2лd Floor, Mrudul Tower, B/h. Times of India, Ashram Road. Ahmedabad - 380009 || Tel. : 079- 66614508 || Website : www.gyscoal.com E- Mail : cs@gyscoal.com || CIN : L27209GJ1999PLC036656

CORRIGENDUM

ADDENDUM TO THE NOTICE CONVENING THE EXTRA ORDINARY GENARAL MEETING TO BE HELD ON 12/05/2023 This is with reference to the Notice dated 10-04-2023 for the Extra-Ordinary Genera Meeting and e-voting to be Held on Friday, May 12, 2023, read with earlier newspaper published on 20/04/2023 in Financial Express (English & Gujarati edition), we hereby

Meeting and e-voting to be Held on Friday, May 12, 2023, read with earlier newspaper published on 20/04/2023 in Financial Express (English & Gujarati edition), we hereby wish to bring your kind attention to the following further explanation by way of this corrigendum (addendum) to the following explanatory statement for Item no 4, 5 & 6 to the EOGM notice as mention herein above:

1. Modification to the item no. 6 heading -"Issue Pricing" (after re-computation as per regulation 164, 166A of SEBI (ICDR) Regulation, 2018):
The issue price of the Preferential Issue and Allotment Of 12,70,00,000 Equity Shares shall be at an Issue Price Of Rs. 3.24 [Rs. 1/- Face Value + Rs. 2.24/- Premium Per Share] To Mona Viral Shah - Promoter (By Way Of Conversion Of Loan Into Equity Shares) And Non-Promoters Respectively and Issue Of 2,40,00,000 Convertible Warrants Into Equity Shares shall be at an Issue Price Of Rs. 3.24 [Rs. 1/- Face Value + Rs. 2.24/- Premium Per Share] To Mona Viral Shah - Promoter By Way Of Conversion Of Loan Into Equity Shares. Further, in Item No. 5,6 & their respective notes Issue Price shall be read as Rs. 3.24 (after re computation as per regulation 164, 166A of SEBI (ICDR) Regulation, 2018) instead of Rs. 3.10 wherever it is mentioned in the Notice. Please note that Mona Shah, promoter & director has participated in the present preferential issue by way of conversion of her outstanding loan mount to be adjusted as mentioned in the notice shall be modified with the issue price i.e. from Rs.3.10 to Rs.3.24/-.

2. Modification to the item no 4 to the explanatory statement "RE-CLASSIFICATION"

Modification to the item no 4 to the explanatory statement - "RE-CLASSIFICATION OF PROMOTER & PROMOTER(S) GROUP TO PUBLIC CATEGOTY" (There was a prographical error in the explanatory statement to the item no-4 heading confirmation by the Outgoing Promoters": the line be and hereby now read as The Outgoing Promoters in their respective request letter in mail have not confirme

that, they along with the persons related to them."
"Further, the Outgoing Promoters have not confirmed that subsequent to reclassification, they shall continue to comply with the provisions of Regulation (4) of the Listing Regulations." his corrigendum to the Notice convening the EOGM to be held on 12-05-2023 shall

orm an integral part of the EOGM Notice date. Accordingly all the concerne stock exchanges, depositories, registrar, transfer agent and all stakel equested to take note of revision / modification. This corrigendum is available on the website of the company at www.gyscoal.com

and is being communicated to stock exchange i.e. BSE Limited and National Stock Exchange of India Limited where the shares are listed.

Date: May 05, 2023 Place: Ahmedabad For, Gyscoal Alloys Limited

WORLD LEADER IN AIR COOLING

SYMPHONY LIMITED

(₹ in Crores)

Extract of Standalone Financial Results for the Quarter and Year Ended on March 31, 2023					
	Quarter	Year Ended	Quarter	Year Ended	
	Ended		Ended		
Particulars	31-Mar-23	31-Mar-23	31-Mar-22	31-Mar-22	
	(Refer Note	(Audited)	(Refer Note	(Audited)	
	No.2)		No.2)		
Revenue from operations	239	885	251	641	
Profit/(Loss) before tax *	56	216	58	146	
Net Profit after Tax for the year/period *	43	165	43	111	
Total Comprehensive Income for the year/period [Comprising Profit	42	156	43	115	
for the year/period (after tax) and Other Comprehensive Income					
(after tax)]					
Paid-up Equity Share Capital (Face Value ₹ 2/- per share)	14	14	14	14	
Reserves excluding Revaluation Reserve		898		812	
Earnings Per Share (of ₹ 2/- each)#					
Basic & diluted (₹)	6.17	23.56	6.15	15.84	

Extract of Consolidated Financial Results for the Quarter and Year Ended on March 31, 2023						
	Quarter Ended	Year Ended	Quarter Ended	Year Ended		
Particulars	31-Mar-23	31-Mar-23	31-Mar-22	31-Mar-22		
	(Refer Note	(Audited)	(Refer Note	(Audited)		
	No.2)		No.2)			
Revenue from operations	308	1,188	384	1,039		
Profit/(Loss) before tax *	23	152	90	168		
Net Profit after Tax for the year/period *	16	116	64	121		
Total Comprehensive Income for the year/period [Comprising Profit	15	107	64	125		
for the year/period (after tax) and Other Comprehensive Income (after tax)]						
Paid-up Equity Share Capital (Face Value ₹ 2/- per share)	14	14	14	14		
Reserves excluding Revaluation Reserve		867		826		
Earnings Per Share (of ₹ 2/- each)#						
Basic & diluted (₹)	2.29	16.66	9.05	17.20		
* There was no exceptional / extraordinary item during any of the above periods.						

EPS is not annualised for the guarter ended March 31, 2023 and March 31, 2022.

NOTES:

1. The shareholders on March 15, 2023 approved the buy back of shares at a price of ₹ 2,000/- per share up to 10,00,000 equity shares being 1.43% of the total paid up capital for an aggregate amount not exceeding ₹200 crores (excluding buyback tax and other incidental expenses). The Company has opened the buy back offer on May 03, 2023 and it will be closed on May

2. The figures for the quarter ended March 31, 2023 and March 31, 2022 are balancing figures between audited figures in respect of the full financial year and year to date figures upto the third quarter of the relevant financial year, which were

3. The above is an extract of detailed format of quarterly/year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly/year ended Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com, www. bseindia.com and on Company's website www.symphonylimited.com

> By Order Of The Board For Symphony Limited **Achal Bakeri**

Chairman & Managing Director DIN-00397573

Sympheny

World's leading air cooling company. Available in more than 60 countries.

Place: Ahmedabad

Date: May 05, 2023

Regd. Off: Symphony Limited, Symphony House, FP-12 TP-50, Bodakdev, Off SG Highway, Ahmedabad 380059, india.

CIN: L32201GJ1988PLC010331 | Web: www.symphonylimited.com | Email: corporate@symphonylimited.com | Phone: +91-79-66211111 | Fax: +91-79-66211139

MOVICOL DIET3D TOUCH CLOUD SILVER STORM DIET MOOOL WINTER SUMO JUMBO DUEJ, Arctic Circle MONOCA KI GELAIR EBONAIRE